

M.A. (ECONOMICS) SEMESTER - 1 (CBCS) Examination
OCT/NOV-2024 (AS PER SYLLABUS YEAR JUNE-2023)
Macro Economics-1 (Core (New-23))

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	રાષ્ટ્રીય આવકના વિવિધ ખ્યાલો જણાવીને રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૧	રાષ્ટ્રીય આવક નિર્ધારણ (રોજગારી નિર્ધારણ) અંગેનો કેઇન્સનો અભિગમ સમજાવો.	
પ્રશ્ન.૨	ફિશરનો નાણાં પરિમાણનો સિદ્ધાંત સમજાવો. (MV=PT)	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૨	મિલ્ટન ફ્રીડમેનનો નાણાં પરિમાણનો સિદ્ધાંત સમજાવો.	
પ્રશ્ન.૩	મૂડીરોકાણનો અર્થ અને તેના નિર્ધારક પરિબલો સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૩	ગુણકનો ખ્યાલ સવિસ્તારથી સમજાવો.	
પ્રશ્ન.૪	મોડીગ્લીઆનીનો નાણાંની માંગનો અભિગમ સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૪	નાણાં બજારનો અર્થ અને તેના મુખ્ય સાધનો (ઘટકો) સમજાવો.	
પ્રશ્ન.૫	ટૂંક નોંધ લખો (કોઈ પણ બે)	(૧૪)
	1. રાષ્ટ્રીય આવકના સામાજિક હિસાબોનું મહત્વ. 2. કેઇન્સનો નાણાં (વ્યાજ)નો તરલતા પસંદગીનો સિદ્ધાંત. 3. મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને મૂડીરોકાણ. 4. નાણાંના પુરવઠા અંગે RBIનો અભિગમ.	

ENGLISH VERSION

Que.1	State the various concepts of national income and explain the methods of measuring national income.	(14)
	OR	
Que.1	Explain Keynes' approach to national income determination (employment determination)	
Que.2	Explain Fisher's quantity theory of money. (MV=PT)	(14)
	OR	
Que.2	Explain Milton Friedman's quantity theory of money.	
Que.3	Explain the meaning of investment and its determinants.	(14)
	OR	
Que.3	Explain the concept of multiplier in detail.	
Que.4	Explain Modigliani's approach to demand of money.	(14)
	OR	
Que.4	Explain the meaning of money market and its main instruments (components).	
Que.5	Write Short note (Any Two)	(14)
	1. Importance of Social Accounts of National Income. 2. Keynes' theory of money (interest) liquidity preference. 3. Marginal efficiency of capital and investment. 4. RBI's approach to money supply.	
